

RAN-2508000605020017

T.Y.B.Com. (NCF-NEP) (Sem. V) Examination March - 2026
Major - Tax Procedure And Practice (Paper - 6)

Time: 2 Hours]
[Total Marks: 25

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book. (2) જમણી બાજુના આંકડા પ્રશ્નના સંપૂર્ણ ગુણ દર્શાવે છે. Figure to the right indicates full marks of the question.	Seat No.: Student's Signature
---	--

- પ્ર.1. ટૂંકમાં જવાબ આપો (ગમે તે પાંચ) 10**
Answer in brief. (Any Five)
1. ઝીરો રેટેડ પુરવઠો શું છે?
What is Zero rated Supply?
 2. કસ્ટમ્સ સ્ટેશન શું છે?
What is Customs Station?
 3. કલમ 150 મુજબ ઈન્ફોર્મેશન રિટર્ન ન આપવાના બદલામાં શું દંડ છે?
What is penalty for Failure to furnish Information Return u/s 150?
 4. પૂર્ણ સ્વરૂપ આપો : DIN, EOU
Give Full form : DIN, EOU
 5. કલમ 74 હેઠળ શો-કૉઝ નોટિસ આપવા માટેની સમય મર્યાદા કેટલી છે?
What is time limit to issue show cause notice under section 74?
 6. કલમ 76 મુજબ ગ્રાહકો પાસેથી વસૂલ કરેલો ટેક્સ સરકારને ન ચૂકવવા બદલ કયો દંડ છે?
State the penalty for failure to pay tax collected from customers under Section 76.
 7. કલમ 78 મુજબ યોગ્ય અધિકારી 3 મહિનાની સમયમર્યાદા ઓછી કરી શકે છે? જો હા, તો કઈ પરિસ્થિતિમાં?
Can the proper officer reduce the period of 3 months under Section 78?
If yes, in what circumstances?
- પ્ર.2. (અ) સમજાવો : માલ અને સેવાઓની આયાત (Import) અને તેની કરપાત્રતા (Taxability) 08**
 Explain: Import of goods and services and their taxability
- (બ) સમજાવો : GST હેઠળના વિવિધ પ્રકારના ગુનાઓ અને તેના માટેના દંડ 07**
 Explain various types of offences under GST and Penalties for that.
- અથવા**
- પ્ર.2. ટૂંક નોંધો : 15**
- (અ) આયાત કરેલા માલ અને સેવાઓ પર ચૂકવેલા IGST નો ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)
ITC of IGST paid on imported goods and Services
 - (બ) કંપનીઓ દ્વારા કરાયેલા ગુનાઓ (કલમ 137)
Offences by companies (Section 137)
 - (ક) કલમ - 73 હેઠળ શો-કૉઝ નોટિસ જારી થાય તે પહેલા કરની ચૂકવણી
Payment of tax before issuance of Show Cause Notice under section 73